

જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧/૧૧/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૦૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૦૩ કેસ કરી, ૦૩ વ્યક્તિઓને ઝડપી ૦૪ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૦૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૨૦૦૮/૧૬

શહેરકોટડા : હેતલબહેન રાજુભાઈ શર્મા (ઉ.વ.૧૭)(રહે, સેન્ટ્રમ પાર્ક ફ્લેટ, હરીભાઈ ગોદાણી સર્કલ પાસે સરસપુર) ને તા.૩૧/૧૦/૧૬ ના કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી આરોપી રવિ બાલુસિંહ પરમાર (ઉ.વ.૨૧)(રહે,બેરા પિતામ્બરની ચાલી,રોઝી સીનેમા પાસે સાંરંગપૂર) લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ હેતલબહેનનાં પિતા રાજુભાઈ શર્માએ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એસ.એમ.ચૌધરી ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૦૦૯/૧૬

એલીસબ્રીજ : કીરીટકુમાર રસીકચંદ શાહ (ઉ.વ.૬૫)(રહે,રસીકવીલા બંગલો, સ્ટેટ બેંકની બાજુમાં પોલીટેકનીક આંબાવાડી)એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૧૦/૧૬ ના કલાક ૬/૦૦ થી તા.૩૧/૧૦/૧૬ ના કલાક ૭/૦૦ સુધીનાં સમયગાળા દરમ્યાન પોતાનાં બંધ મકાનમાં બેડરૂમનાં એ.સી.નો ભાગ અંદર નાંખી, તેના વાટે કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીઓના દરવાજા તથા તાળા તોડી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, ઘડીયાળો અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૩૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.એસ.રબારી ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૨૦૧૦/૧૬

સેટેલાઇટ : રંજનબેન વા/ઓ હરીશભાઇ શાહ (ઉ.વ.૬૨)(રહે,લલીતાપાર્ક સોસાયટી, ઇશ્વરભુવન પાસે નવરંગપુરા) તા.૩૧/૧૦/૧૬ નાં કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે સેટેલાઇટ આર્યવતબંજ્જોઝ નં ૫ ના કોર્નર નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ (૩૦ થી ૩૫ વર્ષના આશરાના) રંજનબેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રંજનબેન શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એમ.યુ.મશી ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૨૦૧૧/૧૬

સાબરમતી : દિપકજી વિરચંદજી ઠાકોર (ઉ.વ.૨૯)(રહે.જે.પી.ની ચાલી, પંચ કુવાની બાજુમાં, પાવર હાઉસ સાબરમતી) એ કોઈ અગમ્ય કારણસર તા ૩૧/૧૦/૧૬ સાંજનાં ૫/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે લાકડાનાં દોરીયા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિનેશભાઇ મંગુભાઇ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.